



# ભારતીય જનતા પાર્ટી

## ગુજરાત પ્રદેશ

### શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

પ્રેસનોટ.૦૧

તા.૨૮.૧૨.૨૦૧૭

## ફી અધિનિયમ બદલ રાજ્ય સરકારને અને ટ્રિપલ તલાક અંગેના કાયદા માટે કેન્દ્ર સરકારને અભિનંદન આપતું ભાજપ

### પ્રદેશ ભાજપ દ્વારા આગામી ૧૦ જાન્યુઆરી સુધી ફી અધિનિયમ જાગૃતતા અને રાજ્ય સરકારને અભિનંદનનું અભિયાન

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ દ્વારા ખાનગી શાળા ફી અધિનિયમ અંગે જાગૃતતા અને તેની જોગવાઈ બદલ રાજ્ય સરકારને અભિનંદન આપતા કાર્યક્રમો આગામી ૧૦ જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં અભિયાન સ્વૈચ્છીક સંસ્થાઓ, શૈક્ષણિક સંગઠનો, વાલીમંડળ સાથે મળી હાથ ધરાશે.

શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપાની મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે ગુજરાતના શિક્ષણ જગત સાથે સંકળાયેલ, વાલીઓની મુઝવાણને દુર કરતો ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમ - ૨૦૧૭ કાયદો શેહશરમ રાખ્યા વગર ગુજરાત વિધાનસભામાં પસાર કર્યો હતો. આ કાયદાને નામદાર ગુજરાત હાઈકોર્ટે બંધારણીય ગણવાનો ચુકાદો તારીખ ૨૭ મી ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ આપ્યો છે. જે ભાજપા સરકારની પ્રતિબદ્ધતા પર મહોર સમાન છે.

શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતના નાગરિકોમાં શિક્ષણને મોંઘુ કરવાની, સ્વનિર્ભર શિક્ષણને પ્રોત્સાહન આપવાની ટીકાઓ સતત કરવામાં આવતી હતી. આ ટીકાઓ અને વિરોધીઓના ગાલ પર તમાચો મારવા સમાન ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. ભાજપાની નીતિ જનકલ્યાણલક્ષી છે તે બાબત પુરવાર થઈ છે.



# ભારતીય જનતા પાર્ટી

## ગુજરાત પ્રદેશ

### શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

//૨//

શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ૩૭ લાખ જેટલા વિદ્યાર્થીઓના વાલીશ્રીઓને મોંઘી ફી માંથી રાહત આપતો આ અધિનિયમ અને આનુષંગિક બાબતે સ્વૈચ્છીક સંસ્થાઓ અને વિવિધ વાલીમંડળ-શૈક્ષણિક મંડળો સાથે મળી ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ ૧૦ જાન્યુઆરી સુધી જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે. આ અધિનિયમ થકી શૈક્ષણિક જગતમાં એક ઐતિહાસિક નિર્ણય બદલ રાજ્ય સરકારને અભિનંદન આપતાં બેનર-હોર્ડિંગ્સ, વોલપેઈન્ટીંગ, સભા દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરાશે.

શ્રી વાઘાણીએ ગઈકાલે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપાની કેન્દ્ર સરકાર દ્વારા નારી સન્માન અને નારીને અધિકાર બક્ષતો ટ્રિપલ તલાક પ્રતિબંધ અને સજની જોગવાઈ અંગેનો કાયદો લોકસભામાં પસાર કર્યો છે તે બદલ કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા હતા.

શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપ મતબેન્કની રાજનીતિ નહિ પરંતુ “સૌનો સાથ, સૌનો વિકાસ”ના મંત્રને લઈ જનસામાન્યના આત્મ ગૌરવ અને સ્વમાનને ધ્યાને રાખી કાર્ય કરી રહી છે.

છેલ્લા સાડાત્રણ વર્ષમાં અનેકવિધ યોજનાઓ અને પગલાંઓ લઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોના ઉત્થાનની દિશામાં સીમા ચિન્હરૂપ કાર્ય કર્યું છે એમ શ્રી વાઘાણીએ જણાવ્યું હતું.

(ડૉ. ડર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર - મીડિયા સેલ